

RAJKOT MUNICIPAL CORPORATION

Central Workshop, Opp.Sitaram Weigh Bridge,
Bhavnagar Road, Rajkot-360003



મારું રાજકોટ
સ્વચ્છ રાજકોટ
સર્વેક્ષણ
2021

TENDER NO. RMC/Central Workshop/SWM/03/2021-22

TENDER TECHNICAL BID FOR

Three years rate contract for repairing of various Mobile Toilet Vehicle of solid waste management department

MILESTONE DATES

Tender available on RMC web site & Physical at central workshop	07/09/2021 to 17/09/2021 upto 18.00 Hours
Last date & Time for Offline Distribution of tender	17/09/2021 Upto 18.00 Hours IST
Physical submission of Qualification documents, EMD, Tender Fee etc.	Upto 20/09/2021 during office hours.(Through Reg. AD or Speed Post only)
Offline Opening of Technical Bid	21/09/2021 at 12.00 Hours IST onwards (If Possible)
Offline Opening of Price Bid of the Evaluated Tender	21/09/2021 at 12.00 Hours IST onwards (If Possible)

2021-22

Deputy Commissioner (East Zone)
RAJKOT MUNICIPAL CORPORATION
RAJKOT - (Gujarat)

રાજકોટ મહાનગરપાલિકા

ટેન્ડર નોટીસ

રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ - સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના મોબાઈલ ટોઇલેટના રીપેરીંગ કામ માટેનો ત્રિ-વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ કરવા માટે નીચે મુજબની લાયકાતો ધરાવતા કોન્ટ્રાક્ટરો પાસેથી ફીઝીકલ ટેન્ડર દ્વારા ટુ બીડ સીસ્ટમથી ટેન્ડરો મંગાવવામાં આવે છે.

- 1) GST રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ.
- 2) લેબર લાયસન્સ અને પી.એફ.કોડ રજીસ્ટ્રેશન (જો લાગુ પડતું હોય તો).
- 3) છેલ્લા સાત નાણાકીય વર્ષનું સરેરાશ રૂ.૦૨.૫૦ લાખનું ઓછામાં ઓછું ટર્નઓવર (CA સર્ટિફિકેટ સાથેનું).
- 4) વર્ષનું સરેરાશ રૂ.૧.૨૫ લાખનું ઓછામાં ઓછું વર્કિંગ કેપીટલ.
- 5) રૂ. ૧.૦૦ લાખનું ચાલુ નાણાકીય વર્ષનું સોલવન્સી સર્ટીફિકેટ (Scheduled or Nationalized Bank).
- 6) છેલ્લા સાત નાણાકીય વર્ષમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટનાં સાધનો સપ્લાય કરવાનો અથવા તેના રીપેરીંગ કામગીરી, ડેબ્રિકેશન કામ અંગેનો એક કામનો સરકારી કે અર્ધસરકારી સંસ્થા સાથેનો અનુભવ.
- 7) ડેબ્રિકેશન કામ માટે તમામ સવલતો સાથેનાં વર્કશોપની સગવડતા.
- 8) ભારતમાં કોઈ પણ જગ્યાએ બ્લેક લીસ્ટેડ થયેલ હોવા જોઈએ નહીં. (રૂ.૩૦૦/- ના નોન-જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપર પર લખાણ)
- 9) ટેન્ડરની સાથે ભાવ ભરનાર એજન્સી દ્વારા આપવામાં આવેલ ડોક્યુમેન્ટો તમામ પ્રકારે correct અને genuine છે તે અંગેનું રૂ.૩૦૦/- ના નોન-જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપર પર લખાણ)

૧.	કામનું નામ	સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના મોબાઈલ ટોઇલેટના રીપેરીંગ કામ માટેનો ત્રિ-વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ.
૨.	અર્નેસ્ટ મની	રૂ. ૧૫,૦૦૦/- (ડિમાન્ડ ડ્રાફ્ટના ફોર્મમાં) "કમિશ્નરશ્રી, રાજકોટ મહાનગરપાલિકા" નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ
૩.	ટેન્ડર ફી	રૂ. ૭૫૦/- (નોન રીફન્ડેબલ) (ડિમાન્ડ ડ્રાફ્ટના ફોર્મમાં) "કમિશ્નરશ્રી, રાજકોટ મહાનગરપાલિકા" નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા રૂ.૭૫૦/- એકાઉન્ટ શાખામાં ભરપાઈ કરવી.
૪.	લાયકાતના ડોક્યુમેન્ટનું તથા ઈ.એમ.ડી. તથા ટેન્ડર ફી ફીઝીકલ સબમીશન કરવાનું સ્થળ તથા તારીખ	તા.૦૭/૦૯/૨૦૨૧ થી તા.૧૭/૦૯/૨૦૨૧ દરમિયાન નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ/સ્પીડ પોસ્ટ મારફતે નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી (ઓટો.), સેન્ટ્રલ વર્કશોપ, રાજકોટ મહાનગરપાલિકા, ભાવનગર રોડ, રાજકોટ-૩૬૦૦૦૩.

ટેન્ડર ભરનાર પાર્ટીએ નિયત કરેલ ટેન્ડર ફી રૂ.૭૫૦/- એકાઉન્ટ શાખામાં ભરપાઈ કરી, ટેકનીકલ બીડ તથા પ્રાઈઝ બિડની કોપી સેન્ટ્રલ વર્કશોપ શાખાની ઓફીસ પરથી લઈને, તેના દરેક પાના ઉપર સહી સિક્કા કરી, લાયકાતના ડોક્યુમેન્ટસ સાથે તથા ઈ.એમ.ડી. ના ડીમાન્ડ ડ્રાફ્ટ સાથે ઉપર દર્શાવ્યા મુજબના સરનામે રજી. પોસ્ટ/સ્પીડ પોસ્ટ મારફતે જમા કરાવવાના રહેશે, રૂબરૂ ડોક્યુમેન્ટ-ટેકનીકલ બીડ સ્વીકારવામાં આવશે નહિ.

કોઈપણ કે તમામ ટેન્ડરો સ્વીકારવા કે અસ્વીકાર કરવાનો હક્ક રાજકોટ મહાનગરપાલિકા અબાધિત રાખે છે. તેમજ આ કામે કોઈપણ વાદવિવાદ થાય તો કમિશ્નરશ્રી, રાજકોટ મહાનગરપાલિકાનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે તથા કોર્ટ મેટર થાય તો અધિકારક્ષેત્ર રાજકોટ રહેશે.

નાયબ કમિશ્નર
(પૂર્વ ઝોન)
રાજકોટ મહાનગરપાલિકા

મૂળ ભાવપત્રક

પરીશીષ્ટ - અ

મોબાઈલ ટોઇલેટ રીપેરીંગ કામનું મૂળ ભાવ પત્રક

ક્રમ	વિગત	દર	બેઝીક ભાવ (₹)
૧	ખરાબ થઇ ગયેલ Toilet Tub ને બહાર કાઢી, નવા Toilet Tub ને ફીટીંગ કરી, કમ્પ્લીટ કરી આપવાનું કામ	પ્રતિ જોબ	૨૨૦૦.૦૦
૨	કોઈ પણ જગ્યાએ ખરાબ થઇ ગયેલ સ્ટ્રક્ચરમાં જરૂરીયાત મુજબ 16 Gauge Galvanized Sheet સાથે રીપેરીંગ કરી, વેલ્ડીંગ, રીવેટીંગ વિગેરે કમ્પ્લીટ કરી આપવાનું કામ.	પ્રતિ જોબ	૩૨૫.૦૦
૩	કોઈ પણ જગ્યાએ ખરાબ થઇ ગયેલ સ્ટ્રક્ચરમાં જરૂરીયાત મુજબ 25x25x16 Gauge M.S. Sq. Pipe and M.S. Angle સાથે રીપેરીંગ કરી, વેલ્ડીંગ, વિગેરે કમ્પ્લીટ કરી આપવાનું કામ.	પ્રતિ જોબ	૧૦૫.૦૦
૪	મોબાઈલ ટોઇલેટના દરવાજા બેન્ડ થઇ ગયેલ હોય, તેમજ હિન્જીસ ખરાબ થઇ ગયેલ હોય, દરવાજો ઉતારી, નવા હિન્જીસ ફીટીંગ કરી, એલાઈમેન્ટ કરી, કમ્પ્લીટ થયેલ દરવાજાને મોબાઈલ ટોઇલેટમાં વ્યવસ્થિત ફીટ કરી આપવાનું કામ.	પ્રતિ જોબ	૨૨૦૦.૦૦
૫	મોબાઈલ ટોઇલેટના દરવાજામાં ખરાબ થઇ ગયેલ એલ્યુમીનીયમ સ્ટોપર, હેન્ડલ બહાર કાઢી, નવી એલ્યુમીનીયમ સ્ટોપર, હેન્ડલ વિગેરે ફીટીંગ કરી આપવાનું કામ.	પ્રતિ નંગ	૫૨૫.૦૦
૬	મોબાઈલ ટોઇલેટના ખરાબ થઇ ગયેલ પેનલીંગ તથા રૂફ માં 16 Gauge Galvanized Sheet સાથે જરૂરી સાથે રીપેરીંગ કરી, વેલ્ડીંગ, રીવેટીંગ વિગેરે કમ્પ્લીટ કરી આપવાનું કામ.	પ્રતિ જોબ	૨૫૦.૦૦
૭	મોબાઈલ ટોઇલેટના સાઇડ પ્લેટફોર્મમાં ખરાબ થઇ ગયેલ M.S. Sq. Pipe of 40 mm & 20 mm સાથે જરૂરી સાથે રીપેરીંગ કરી, વેલ્ડીંગ કરી, કમ્પ્લીટ કરી આપવાનું કામ.	પ્રતિ જોબ	૧૩૦.૦૦
૮	મોબાઈલ ટોઇલેટના સાઇડ લેડરમાં ખરાબ થઇ ગયેલ 3.0 mm Aluminum Chaquered plate બહાર કાઢી, નવી 3.0 mm Aluminum Chaquered plate ફિટિંગ કરી, કમ્પ્લીટ કરી આપવાનું કામ.	પ્રતિ જોબ	૩૮૦.૦૦
૯	મોબાઈલ ટોઇલેટના સાઇડ લેડરમાં હિન્જીસ, ઉપર નીચે થઇ શકે તેમ ન હોય, તેવી સ્થિતિમાં જરૂરીયાત મુજબ રીપેરીંગ કરી, કમ્પ્લીટ કરી આપવાનું કામ.	પ્રતિ જોબ	૧૨૫૦.૦૦
૧૦	મોબાઈલ ટોઇલેટની સ્લજ ટેક/વોટર ટેન્કમાં લીકેજ હોય, ત્યાં જરૂરીયાત મુજબ S S વેલ્ડીંગ કરી, કમ્પ્લીટ કરી, લીકેજ બંધ કરી આપવાનું કામ.	પ્રતિ જોબ	૪૬૦૦.૦૦
૧૧	મોબાઈલ ટોઇલેટની સ્લજ ટેકમાં ખરાબ થઇ ગયેલ ગયેલ અથવા જામ થયેલ ગયેલ 100 mm dia. ના બોલ વાલ્વને સ્લીવ સાથે બહાર કાઢી, જરૂરીયાત મુજબ સર્વિસ કરી, પરત સ્લીવ સાથે વાલ્વને ફિટિંગ કરી આપવાનું કામ.	પ્રતિ નંગ	૭૫૦.૦૦
૧૨	મોબાઈલ ટોઇલેટની વોટર ટેકમાંથી પાઈપ મારફત ટોઇલેટ કેબિનમાં નળમાં પાણી આવતું બંધ થઇ જાય, તેમાં જરૂરીયાત મુજબ પ્લમ્બિંગ લાઈન ચેક કરી, જરૂરી રીપેરીંગ કરી, ટોઇલેટ કેબિન સુધી પાણી પહોંચતું કરી આપવાનું કામ.	પ્રતિ જોબ	૭૦૦.૦૦
૧૩	મોબાઈલ ટોઇલેટની કેબિનમાં ખરાબ થઇ ગયેલ નળ બહાર કાઢી, નવા નળ ફીટીંગ કરવાનું કામ.	પ્રતિ નંગ	૧૫૦.૦૦

૧૪	મોબાઈલ ટોઇલેટની કેબિનમાં ખરાબ થઇ ગયેલ ફલસ વાલ્વ બહાર કાઢી, નવા નળ ફીટીંગ કરવાનું કામ.	પ્રતિ નંગ	૮૦૦.૦૦
૧૫	મોબાઈલ ટોઇલેટમાં વોસ બેસિન માટેની ગેંડી બહાર કાઢી, નવી ગેંડીમાં જરૂરીયાત મુજબ વેલ્ડીંગ, નટ-બોલ્ટ સાથે ફીટીંગ કરવાનું કામ.	પ્રતિ નંગ	૭૦૦.૦૦
૧૬	મોબાઈલ ટોઇલેટમાં વોસ બેસિન પાસે નેપકીન સ્ટેન્ડ તથા સાબુદાની ને જરૂરીયાત મુજબ રીપરીંગ કરી, કમ્પ્લીટ કરી આપવાનું.	પ્રતિ જોબ	૪૪૦.૦૦
૧૭	મોબાઈલ ટોઇલેટમાં વોસ બેસિન પાસે તૂટી ગયેલ કાચ બહાર કાઢી, નવો કાચ ફિટિંગ કરી, કમ્પ્લીટ કરી આપવાનું. (કાચની સાઈઝ ૧૦"X ૧૫") (માલ-મજૂરી સાથે)	પ્રતિ જોબ	૫૦૦.૦૦
૧૮	મોબાઈલ ટોઇલેટમાં ૦૨ હાથ Anti-Corrosive Zinc Base Primer મારી, તેના પર ૦૨ હાથ અત્રેથી સૂચવ્યા મુજબનો કલર કરી, કમ્પ્લીટ કરી આપવાનું કામ.	પ્રતિ જોબ	૧૪૦૦૦.૦૦
૧૯	મોબાઈલ ટોઇલેટની ચેસીસમાં ખરાબ થઇ ગયેલ/તૂટી ગયેલ એક્સલના હબને બહાર કાઢી, નવો હબ એક્સલમા બેરીંગ સાથે ફિટિંગ કરી, કમ્પ્લીટ ફિટિંગ કરી આપવાનું કામ.	પ્રતિ જોબ	૩૫૦૦.૦૦
૨૦	મોબાઈલ ટોઇલેટના હબમાં ખરાબ થઇ ગયેલ/તૂટી ગયેલ બેરીંગ બહાર કાઢી, નવા બેરીંગ ફિટિંગ કરી, હબમાં કમ્પ્લીટ ફિટિંગ કરી આપવાનું કામ.	પ્રતિ જોબ	૮૫૦.૦૦

પરીશીષ્ટ - બ
નવા પાર્ટસની વિગતો

ક્રમ	વિગત	દર	બેઝીક ભાવ (₹)
૧	Toilet Tub:- Non-Corrosive And Easy To Clean S.S. Tub. (Cypoon Compulsory) (Toilet Size :- 3'-0" X 2'-5" X 6'-5")	પ્રતિ નંગ	૮૦૦૦.૦૦
૨	Mobile Toilet Doors :- Inside Opening shall be made from 18 Gauge Corrugated Aluminum sheet on Outside & PVC Coated GI sheet on inside paneling with heavy duty Hinges, Aluminum stopper & handle	પ્રતિ નંગ	૩૦૦૦.૦૦
૩	SLUDGE TANK :- 3.0 mm Thick S.S Sheet made from S S 304, 1300 Liters (Approxy)	પ્રતિ નંગ	૫૦૦૦૦.૦૦
૪	WATER TANK :- 3.0 mm Thick S.S Sheet made from S S 304, 1300 Liters (Approxy)	પ્રતિ નંગ	૫૦૦૦૦.૦૦
૫	Sludge drain valve 100mm dia. heavy duty ball valve - CI Valve	પ્રતિ નંગ	૨૫૬૭.૦૦
૬	Sludge drain Sleeve 100mm dia. heavy duty - CI Valve	પ્રતિ નંગ	૨૫૦૦.૦૦
૭	Wash Basins Size (SS) :- 18" Dia.	પ્રતિ નંગ	૧૧૦૦.૦૦
૮	Napkin Hanger :-	પ્રતિ નંગ	૧૫૦.૦૦
૯	Shop Keeper :-	પ્રતિ નંગ	૧૦૦.૦૦
૧૦	Hub - Material: Cast Steel.	પ્રતિ નંગ	૪૫૦૦.૦૦
૧૧	Bearing :- Type: Taper Roller (SKF/TIMKEN/TATA)	પ્રતિ નંગ	૮૨૬.૦૦
૧૨	Toilet Lamp (a/c Supply)	પ્રતિ નંગ	૨૬.૦૦
૧૩	PVC Taps	પ્રતિ નંગ	૨૦.૦૦
૧૪	Wash Basins, Drain Pipe	પ્રતિ નંગ	૨૫.૦૦

નાયબ કાર્યપાલક ઈજનેર (ઓટો.)
રાજકોટ મહાનગરપાલિકા

નાયબ કમિશ્નર (પૂર્વ ઝોન)
રાજકોટ મહાનગરપાલિકા

રાજકોટ મહાનગરપાલિકા
:: ટેન્ડરની શરતો અને સમજૂતિ ::

- (૧) ભાવ ભરનાર પાર્ટીએ નિયત કરેલ ટેન્ડર ફી રૂ.૭૫૦/- એકાઉન્ટ શાખામાં ભરપાઈ કરી, ટેકનીકલ બીડ તથા પ્રાઈઝ બિડની કોપી સેન્ટ્રલ વર્કશોપ શાખાની ઓફીસ પરથી લઈને, તેના દરેક પાના ઉપર સહી સિક્કા કરી, લાયકાતના તમામ ડોક્યુમેન્ટ્સ સાથે તથા ઈ.એમ.ડી. ના ડિમાન્ડ ડ્રાફ્ટ "કમિશ્નરશ્રી, રાજકોટ મહાનગરપાલિકા" ના નામનો ફીઝીકલી સબમીશન સમયે રજૂ કરવાનો રહેશે.
- (૨) આ કામનો રેઈટ-કોન્ટ્રાક્ટ કરવાનો હોય, એજન્સીએ રૂ.૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર મહાનગરપાલિકાની તરફેણમાં ધોરણસરનું કરારનામું કરી આપવાનું રહેશે.
- (૩) આ કામે સીક્યુરીટી ડીપોઝીટ તરીકે રૂ.૭૫,૦૦૦/- ની રકમ બેંક ગેરેન્ટીના (અત્રેથી જણાવ્યા મુજબની બેન્કમાં) ફોર્મમાં કોન્ટ્રાક્ટ પીરીયડથી વધુ ત્રણ માસના સમય માટે (૩૯ મહિના માટે) મહાનગરપાલિકામાં - "કમિશ્નરશ્રી, રાજકોટ મહાનગરપાલિકા" ના નામથી જમા કરાવવાની રહેશે.
- (૪) આ કામે રેઈટ કોન્ટ્રાક્ટની કોઈ પણ આઈટમ જરૂરિયાત મુજબના જથ્થામાં કરી આપવાની રહેશે તેમજ આ કામે મહાનગરપાલિકા પાસે જેટલો કામનો જથ્થો હશે તેટલું કામ આપવામાં આવશે. સતત કામ આપવા માટે મહાનગર પાલિકા બંધાયેલ નથી.
- (૫) આ કામ સંબંધે કાયદાકીય કે અન્ય તકરાર કે લીટીગેશન ઉપસ્થિત થયે કમિશ્નરશ્રીનો નિર્ણય અને હુકમ આખરી ગણાશે. જે ભાવ ભરનાર પાર્ટીને સંપૂર્ણપણે બંધનકર્તા રહેશે.
- (૬) આ કામે આવેલ તમામ ટેન્ડરોની ઓનલાઈન ટેકનીકલ બીડ xx-xx-xxxx નાં રોજ બપોરે ૧૨.૦૦ વાગ્યે રાજકોટ મહાનગરપાલિકા, નાયબ કમિશ્નરશ્રી (પૂર્વ ઝોન)ની ઓફીસમાં ખોલવામાં આવશે. ત્યારે ભાવ ભરનાર કે તેના અધિકૃત પ્રતિનિધિ હાજર રહી શકાશે.
- (૭) આ કામે જે પાર્ટીનાં ભાવો મંજૂર થશે તેમને આ અંગે ખબર મળ્યેથી દિવસ - ૧૦ માં સીક્યુરીટી ડીપોઝીટની રકમ જમા કરાવી, કરારનામું કરી આપવાનું રહેશે.
- (૮) શરતી ટેન્ડરો સ્વીકારવામાં આવશે નહિ અને તે કેન્સલ ગણવામાં આવશે. તેમ છતાં તે સ્વીકારવા કે કેમ ? તે અંગેનો નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીના આધિકારમાં રહેશે અને ભાવ ભરનાર તમામને બંધનકર્તા રહેશે.
- (૯) રાજકોટ મહાનગરપાલિકાના નિયમાનુસાર પદ્ધતિથી ધોરણસર બીલ પાસ થયે પાર્ટીને પેમેન્ટ ચુકવવામાં આવશે.
- (૧૦) આ ટેન્ડરની શરતો કે તેના અર્થઘટન બાબતે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે પ્રશ્ન અંગેનો રાજકોટ મહાનગરપાલિકાનો નિર્ણય ભાવ ભરનાર પાર્ટીને દરેક રીતે બંધનકર્તા રહેશે. તથા કોર્ટ મેટર થાય તો અધિકારક્ષેત્ર રાજકોટ રહેશે.
- (૧૧) આ કામે જે પાર્ટીઓ ટેકનીકલી ક્વોલીફાય થશે તેઓની જ પ્રાઇસ બીડ ખોલવામાં આવશે.
- (૧૨) આ કામે પ્રાઇસ બીડ ખુલ્યા પછી ભાવ સંબંધે ફેરફાર કરવા માટે પુછાવવાની અથવા રૂબરૂ વાટાઘાટ માટે બોલાવવાનો અધિકાર રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે. પરંતુ અમારી સામેથી માંગણી સિવાય ભાવ સંબંધી ફેરફારની કોઈ રજૂઆત માન્ય રાખવી કે કેમ તે મહાનગરપાલિકાના અધિકારમાં રહેશે.

- (૧૩) આ કામે ભાવ ભરનાર પાર્ટીએ ટેન્ડરનાં સ્પેસીફિકેશનો મુજબ કામ કરી આપવાનું રહેશે. જરૂર પડ્યે આ સ્પેસીફિકેશનમાં ફેરફાર કરવાનો હક્ક રાજકોટ મહાનગરપાલિકા અબાધિત રાખે છે.
- (૧૪) આ કામે ભાવ ભરનાર પાર્ટીએ સાઈટ પરના ઇન્ચાર્જ એન્જીનીયરશ્રીની સુચના મુજબ કામ કરી આપવું રહેશે. જરૂરી ગુણવત્તા જાળવી કામ કરવાનું રહેશે. જો આ બાબતે પાર્ટી નિષ્ફળ જશે તો તેના ખર્ચે અને જોખમે રાજકોટ મહાનગરપાલિકા અન્ય પાર્ટી પાસે કામ કરાવી શકશે.
- (૧૫) આ કામે ડીલીવરી સમયે મર્યાદા, વર્ક-ઓર્ડર આપનાર ઓથોરીટી નક્કી કરશે. નિયત મુદતમાં કામ પુરૂ કરવામાં નહિ આવે તો રાજકોટ મહાનગરપાલિકાનાં ધારાધોરણ મુજબ પેનલ્ટી વસુલ કરવામાં આવશે.
- (૧૬) ભાવ ભરનાર પાર્ટીએ સેન્ટ્રલ વર્કશોપ, રાજકોટ મહાનગરપાલિકા, ભાવનગર રોડ, રાજકોટ અથવા સેન્ટ્રલ સ્ટોર, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, ભાવનગર રોડ, રાજકોટ ખાતે પોતાની મશીનરી તેમજ સ્ટાફ લાવી, રીપેરીંગ કરી આપવાનું રહેશે. આ કામે કોઈ પણ આકસ્માત કે જાનહાની થશે તો પાર્ટીને સંપૂર્ણપણે બંધનકર્તા રહેશે. અથવા મોબાઈલ ટોઇલેટ પાર્ટીએ પોતાના ખર્ચે અને જોખમે પોતાની સાઈટ પર લાવવા-લઈ જવાના રહેશે.
- (૧૭) ભાવ ભરનાર પાર્ટીએ પ્રાઇસ બીડમાં ભાવ પત્રકમાં જ ભાવ ભરવાના રહેશે.
- (૧૮) આ કામે કરવાના થતા રેઈટ કોન્ટ્રાક્ટની મુદત વાર્ષિક રહેશે. જે કરારની તારીખથી ગણવામાં આવશે પરંતુ જ્યાં સુધી નવો કોન્ટ્રાક્ટ ન થાય ત્યાં સુધી આ ભાવથી અને શરતો મુજબ રેઈટ કોન્ટ્રાક્ટ ચાલુ રહેશે.
- (૧૯) આ કામે રીપેર થયેલા આઈટમોનું ઇન્સ્પેક્શન પાર્ટીએ ઇન્ચાર્જ સાઈટ એન્જીનીયર પાસે કરાવવાનું રહેશે.
- (૨૦) આ કામે ભાવ ભરનાર પાર્ટીએ ટેકનીકલ બીડમાં માંગેલ જરૂરી દસ્તાવેજોની નકલ ફીઝીકલ સબમીશન સમયે સહી તથા સિક્કા સાથે રજૂ કરવાની રહેશે.
- (૨૧) કોન્ટ્રાક્ટર સેન્ટ્રલ વર્કશોપ ખાતે રીપેરીંગ કરવા માંગે તો વીજ જોડાણ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે. પરંતુ આ અંગેના જરૂરીયાત મુજબના ઇલેક્ટ્રીકલ્સ માલ-સામાન કોન્ટ્રાક્ટરે પોતાના વસાવવાના રહેશે.
- (૨૨) આ કામે મહાનગરપાલિકા એક કરતાં વધારે પાર્ટીઓ સાથે પેરેલલ રેઈટ કોન્ટ્રાક્ટ કરવાનો હક્ક અબાધિત રાખે છે.
- (૨૩) સદરહુ કામે પ્રાઇઝ બીડમાં દર્શાવેલ પરિશિષ્ટ-“અ” તથા “બ” પરના ભાવો પર વાર્ષિક ૧૦% નો ભાવ વધારો આપવામાં આવશે. જે એજન્સી દ્વારા ભરવામાં આવેલ ભાવ પર ગણતરી કરવામાં આવશે.
- (૨૪) આ કામે અન્ય જરૂરીયાત મુજબનું ફેબ્રિકેશન લગત કામગીરી પણ પાર્ટીએ મંજૂર થયેલ ભાવથી રીપેર કરી આપવાની રહેશે.
- (૨૫) **xx-xx-xxxx** થી દર્શાવેલ તારીખો ટેન્ડરનાં પ્રથમ પેઈજ પર આપેલ માઈલસ્ટોન તારીખો મુજબ ગણવાની રહેશે.

ભાવ ભરનાર પાર્ટીના
સહી તથા સિક્કા

નાયબ કાર્યપાલક ઇજનેર (ઓટો.)
રાજકોટ મહાનગરપાલિકા

નાયબ કમિશ્નર(પૂર્વ ઝોન)
રાજકોટ મહાનગરપાલિકા